

તવાફ

2



હજરે અસ્વદ થી હજરે અસ્વદ સુધી સાત ચક્કર લગાવવા

- શામ અને ઈજ્પતના લોકો માટે મક્કિત અલ-જુહુફા 186 કમી
- મદનિના લોકો માટે મક્કિત ઝુલ હુલયફા 420 કમી
- ઈરાક ના લોકો માટે મક્કિત ઝત અરક 98 કમી
- નજદના લોકો માટે મક્કિત કુર્ન અલ મનાઝીલ 99 કમી
- યમનના લોકો માટે મક્કિત યલમલમ 99 કમી

1

એહરામ

ઉમરાહ ની નયિત

પ્લેન દ્વારા આવનારાઓની મક્કિત આકાશ માં નજીક ની મક્કિતના એર પોઈન્ટ પર

સાત ચક્કર લગાવવા

સઈ દરમિયાન ફક્ત પુરુષોએ બે લીલી લાઈટ વચ્ચે ઝડપથી ચાલવું

મરવાહ

સફા અને મરવાહ વચ્ચે સઈ કરવી

4

મકામે ઈબ્રાહમિ પાછળ બે રકાત નમાઝ (શફ્ય તેટલી નજીક)

3

એહરામ ના પ્રતબિધો

- 1 માથાના અથવા શરીરના વાળ દૂર કરવા જોઈએ નહી
- 2 નખ કાપવા જોઈએ નહી
- 3 ખુશ્બુ નો ઉપયોગ કરવો જોઈએ નહી
- 4 પોતાના માટે અથવા બીજા ના માટે નકીહનો કરાર કરવો જોઈએ નહી
- 5 હમબસિતરી કરવી જોઈએ નહી
- 6 જાનવરોનો શકિર કરવો નહી

ફક્ત પુરુષો માટે પ્રતબિધોના પ્રકાર

- 1 સલિઈ વાળા કપડાં પહેરવાં જોઈએ નહી
- 2 અમામા કે ટોપી વડે માથું ઢાંકવું જોઈએ નહી
- 1 નકાબ અથવા બુરખો પહેરીને ચહેરા ને ખુલ્લો રાખે પરંતુ ગૈર મેહરમ પુરુષો ની હાજરી માં ચહેરા ને પડદા વડે ઢાંકે
- 2 મોજાં પહેરવા

ફક્ત મહિલાઓ માટે એહરામ

માથાના વાળ મુડાવવા અથવા ટૂંકા કરાવવા

5

માથાના વાળ મુડાવવા અથવા ટૂંકા કરાવવા ફક્ત પુરુષો માટે છે મહિલાઓએ એક ઈચ જેટલા વાળ કપાવવા

ઉમરાહના માટે મુસ્તહબ

- 1 નખ અને વાળ કાપવા જે અહેરામની નયિત કરતાં પહેલાં કરવાની જરૂર છે
- 2 અહેરામ પહેલાં 3 શરીર પર ખુશ્બુ લગાવવી
- 4 પુરુષો માટે બે સફેદ ચાદર અહેરામ તરીકે
- 5 અહેરામ પહેરવાથી લઈ તવાફ શરુ કરે ત્યાં સુધી તલબીયાહ પઢવા (લબૈક અલ્લાહુમ્મા લબૈક, લબૈક લા શરીક લબૈક, ઈન્નલ હમ્દ, વન્નેઅમતા, લકવલ મુલ્ક, લા શરીક લક)
- 6 પુરુષો માટે તવાફ માં ઈજતબિઅ (જમણો ખભો ખુલ્લો રાખે)
- 7 હજરે અસ્વદ ને બોશો આપવો
- 8 પહેલા ત્રણ ચક્કરમાં રમલ કરવું (ઝડપથી ચાલવું)
- 9 મુકામે ઈબ્રાહમિ પાછળ બે રકાત નમાઝ અદા કરવી